

Seat No. : _____

MC-124

March-2022

B.Sc., Sem.-I

CC-101 : Chemistry (General Chemistry)

Time : 2 Hours]

[Max. Marks : 50

- સ્વીકાર્યના : (1) વિભાગ-Iના બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) વિભાગ-I માંથી કોઈપણ ત્રણું પ્રશ્નોના ઉત્તર લખો.
(3) વિભાગ-IIમાં આપેલ પ્રશ્ન નં. 9 ફરજિયાત છે.

વિભાગ - I

1. (A) લેન્થેનાઈડ શ્રેણીના તત્ત્વોના નામ, પ્રકાર્ય, સંજ્ઞા અને ઈલેક્ટ્રોનીય રૂપના લખો. 7
(B) એક્ટેનાઈડ તત્ત્વોની જુદી-જુદી ઓક્સિડેશન સ્થિતિઓ ચર્ચો. 7
2. (A) ઈલેક્ટ્રોનીય રૂપનાને આધારે લેન્થેનાઈડ તત્ત્વોની ઓક્સિડેશન સ્થિતિઓ ચર્ચો. 7
(B) એક્ટેનાઈડ સંકોચન સમજાવો. 7
3. (A) નાઈટ્રોજનના પરિમાપનની જેવાહલની પ્રક્રિયા સમજાવો. 7
(B) SN^2- -પ્રક્રિયાની હિયાવિધી ચર્ચો. 7
4. (A) કાર્બનિક એસિડનો આણુભાર શોધવાની સિલ્વર ક્ષાર પ્રક્રિયા સમજાવો. 7
(B) સહસંયોજક બંધના જુદા-જુદા વિભાજન ચર્ચો. 7
5. (A) આલ્કેનની હેલોજુનેશનની વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. 7
(B) માર્કોવનિકોઝ અને પ્રતિ-માર્કોવનિકોઝ નિયમ સમજાવો. 7
6. (A) β -વિલોપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. 7
(B) ટ્રિઝાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરી આલ્કેન બનાવવાની રીત સમજાવો. 7

7.	(A) પદ્ધ ચર્ચો :	7
	(i) પ્રાણાવીના પ્રકાર	
	(ii) સ્થિતિ વિધેય	
	(B) પ્રથમ કમની પ્રક્રિયા માટેનું ગતિકી સમીકરણ તારવો.	7
8.	(A) થર્મોડાઇનમિક્સનો શૂન્યનો નિયમ સમજાવો. એક એન્જિનની 110°C અને 25°C વચ્ચે મહત્તમ કાર્યક્ષમતા શોધો.	7
	(B) પ્રક્રિયાક્રમ ચર્ચો. એક પ્રથમકમની પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે 30 મિનિટનો સમય લાગે છે. તો 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ?	7
	વિભાગ - II	
9.	નીચેના પ્રશ્નોના જવાબ આપો : (ગમે તે આઠ)	8
	(1) પ્રથમ આંતર સંકાતિ શ્રેણીની રચના કઈ શ્રેણી રચે છે ?	
	(2) લેન્થેનાઈડ તત્ત્વોની સામાન્ય ઈલેક્ટ્રોનીય રચના આપો.	
	(3) એક્ટીનાઈડ સંકોચન શા માટે જોવા મળે છે ?	
	(4) Gd^{+3} આયનનું ઈલેક્ટ્રોનિક બંધારણ આપો.	
	(5) અસમ વિભાજન એટલે શું ?	
	(6) મુક્તમૂલકોની સ્થિરતાનો કમ જણાવો.	
	(7) નીચો પેન્ટેનનું બંધારણીય સૂત્ર દોરો.	
	(8) કયા સંયોજનો પેરાફીન તરીકી ઓળખાય છે ?	
	(9) SN^2 પ્રક્રિયાવિધી એટલે શું ?	
	(10) સિલ્વર ક્ષાર પદ્ધતિની મર્યાદા લાખો.	
	(11) ગ્રિઝાર્ડ પ્રક્રિયક જણાવો.	
	(12) વ્યાખ્યા આપો : પ્રતિ-માર્કોવનિકોઝ નિયમ	
	(13) થર્મોડાઇનમિક્સના પ્રથમ નિયમનું ગાણિતીય સમીકરણ આપો.	
	(14) પ્રથમ કમની પ્રક્રિયા માટે $t_{1/2}$ નાં મૂલ્ય જણાવો.	
	(15) એન્ટ્રોપી કયા પ્રકારનું વિધેય છે ?	
	(16) દ્વિતીય કમની પ્રક્રિયા એટલે શું ?	

Seat No. : _____

MC-124

March-2022

B.Sc., Sem.-I

CC-101 : Chemistry (General Chemistry)

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :**
- (1) All questions in Section-I carry equal marks.
 - (2) Attempt any **three** questions in Section-I.
 - (3) Question **9** in Section-II is compulsory.

Section – I

1. (A) Give name, atomic number, symbol and electronic configuration of Lanthanide elements. 7
(B) Explain various oxidation states of Actinides elements. 7
2. (A) On the basis of electronic configuration, explain various oxidation states of Lanthanide elements. 7
(B) Explain : Actinide contraction. 7
3. (A) Explain the Kjeldahl's method for detection of Nitrogen. 7
(B) Discuss : SN^2 – Mechanism. 7
4. (A) Describe Silver salt method for determination of molecular weight of an carbonic acid. 7
(B) Discuss the various types of fission of Covalent bond. 7
5. (A) Explain Halogenation substitution reaction in alkane. 7
(B) Explain Markownikoff and anti-Markownikoff rules. 7
6. (A) Explain : β -elimination reaction with illustration. 7
(B) Explain the preparation of alkane with use of Grignard reagents. 7

7. (A) Define : 7
(i) Types of System
(ii) State function
- (B) Derive an equation for the first order reaction. 7
8. (A) Explain zero law of thermodynamics. Calculate the maximum efficiency of an engine operating between 110 °C and 25 °C. 7
- (B) Discuss the order of reaction. A first order reaction is completed 25% in 30 mins. How much time is required for completion of 60% reaction ? 7

Section – II

9. Answer the following questions : (Any Eight) 8
- (1) Which series create first inner transition series ?
 - (2) Give the common electronic configuration formula for Lanthanide elements.
 - (3) Why actinide contraction occurs ?
 - (4) Give electronic configuration of Gd^{+3} ion.
 - (5) What is Hetrolytic fission ?
 - (6) Give the order of stability for free radicals.
 - (7) Draw the structure of neo-pentane.
 - (8) Which compounds are known as “Paraffins” ?
 - (9) What is SN^2 -reaction mechanism ?
 - (10) Write the limitation of silver salt method.
 - (11) Show Grignard reagent.
 - (12) Define : Anti Markownikoff rule.
 - (13) Give Mathematical equation for first law of thermodynamics.
 - (14) What will be the value of $t_{1/2}$ for first order reaction ?
 - (15) Which type of function entropy is ?
 - (16) What is second order reaction ?
-